

મર્ડરના ગુનામાં ૦૮ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી,

સુરત શહેર કાર્મ બ્રાંચ

સુરત શહેર વિસ્તારમાં નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા ડી.સી.બી. પો.સ્ટે. ના નાસતા ફરતા/પેરોલ ફ્લો સ્કોર્ડના પોલીસ માણસો વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં રોકાયેલ હતા. દરમ્યાન પો.સ.ઈ. શ્રી.સી.આર.દેસાઈનાઓની ટીમના HC શીવાજી આનંદરાવ અને HC શબ્બીર અકબર નાઓને મળેલ હકીકત આધારે ઓરીસ્સા રાજ્યાના ગંજમ જિલ્લામાં આવેલ બાભનપુર ગામમાંથી આરોપી કાલુચરણ હાડુબંધુ ગૌડ ઉ.વ.૩૧ ધંધો કડીયાકામ હાલ રહે. બાભન પુ.થાના-આસ્કા, જી.ગંજમ. મુળરહે. ગામ-બરડાબીલી, થાના સોરડા જી.ગંજમ (ઓરીસ્સા) નાને પકડી પાડી, સદર આરોપી કતારગામ પો.સ્ટે. ફ્સ્ટ ગુ.ર.નં. ૬૩/૨૦૧૨ ઈ.પી.કો. ક.૩૦૨ મુજબ ગુનામાં વોન્ટેડ હોય, સદર આરોપીની પુછપરછ દરમ્યાન હકીકત એવી રીતે રીતેની છે કે, આ કામનો આરોપી સને - ૨૦૧૨ની સાલમાં પોતાના વતન ઓરીસ્સામાં મખનપુર ગામમાં રહેતી છોકરી સાથે પ્રેમ સબંધ હોય, તેણીને ભગાડી સુરત શહેર લઈ આવી કતારગામ ઉત્કલનગર ખાતે રહેતો હતો. અને આરોપી એમ્બોડરીના કારખાનામાં નોકરી કરતો હતો. દરમ્યાન સુરત શહેરમાં તેમને સંતાનમાં એક દિકરી થયેલ. સદર આરોપીની પત્ની રીન્કીને સંતાનમાં આવેલ દિકરી શ્વેતા પોતાનું સંતાન નહી હોવાનો શક વહેમ રાખી આરોપી તેની પત્નીના ચારીત્ર્ય ઉપર શંક રાખી દિકરી શ્વેતા બાબતે અવર નવર ઝગડો તકરાર કરી મારઝુડ કર્યા કરતો હતો. તેમજ તેની પત્ની બીજી જ્ઞાતીની હોય જેથી તેને લઈ વતનમાં જઈ શકાતુ ન હતુ જેથી આરોપીએ પોતાની પત્નીનુ હત્યા કરવાનુ નક્કી કરી તા.૦૧/૦૩/૨૦૧૨ ના રોજ બપોરના સમયે રીન્કીની સાથે ઝગડો તકરાર કરી તેનુ ગળુ દબાવી હત્યા કરી નાંખી તેમની દિકરી શ્વેતા ઉ.વ.૦૮ મહીનાને ત્યાંજ મુકીને નાસી ગયેલ હતો. ત્યારબાદ આરોપીએ એકાદ વર્ષ પછી વતનમાં બીજા લગ્ન કરી વતન છોડી આસ્કા થાનામાં આવેલ બાભનપુર ગામ ખાતે રહી કડીયાકામની મજુરી કરતો હોય અને પોતાની ધરપકડ ટાળવા આજદીન સુધી નાસતો ફરતો હોય, ડી.સી.બી.પો.સ્ટે.ના પોલીસ માણસોને બાતમી હકીકત આધારે ઓરીસ્સા બાભનપુર ખાતેથી આરોપીને પકડી પાડી, પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.